

અઠવા પો.સ્ટે. ના ખુનના ગુનામાં વચગાળાના જામીન મેળવી, જામીન પરથી ફરાર થયેલ આરોપી ઈબ્રાસ ઉર્ફે ફૈયુ અમીન સુકરી બરફવાલાને ઝડપી પાડતી સુરત શહેર કાઈમ બ્રાન્ચ.

સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં સજા પામેલ તેમજ કાચા કામના કૈદી તરીકે જેલમાંથી પેરોલ રજા ફર્લો રજા અને વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ હોય તેવા રીઠા ગુનેગારો સત્વરે પકડી પાડવા સુરત શહેર કાઈમ બ્રાન્ચના ફર્લો સ્કોડના પોલીસ માણસોની ટીમો બનાવી શહેર વિસ્તારમાં કામગીરીમાં રોકાયેલ હતી, દરમ્યાન પો.સ.ઈ.શ્રી.પી.કે.પટેલ નાઓની ટીમના HC શબ્બીર અકબર તથા PC મનોજ તુકારામ નાઓને મળેલ હકિકત આધારે વચગાળાની જામીન પરથી ફરાર થયેલ આરોપી ઈબ્રાસ ઉર્ફે ફૈયુ અમીન સુકરી બરફવાલા ઉ.વ.૨૮ રહે-ઘર નં. ૧૦/૨૦૭૫, અચ્છીબાઈની ચાલ સીંધીવાડ ભાગાતળાવ, ચોકબજાર, સુરતનાને સોની ફળીયા પાણીની ભીંત પાસે રમેશ પાઉભાજી દુકાનની સામે જાહેર રોડ પરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી, આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલ, સુરત શહેર ખાતે સોપવામાં આવેલ સદર વચગાળા પરથી ફરાર આરોપી મો.ઈબ્રાસ ઉર્ફે ફૈયુ અમીન બરફવાલા નાએ સને-૨૦૧૬ માં તા.૨૨/૦૧/૧૬ ના રોજ ગાડી પાર્કીંગ કરવાની બાબતમાં સમીર પઠાણ અને શાબીર ટેલર નામના ઈસમની સાથે ઝઘડો તકરાર કરી બન્ને જણાને આરોપીએ ચાકુના જીવલેણ ઘા મારેલ જેમાં સમીન પઠાણની હત્યાનો બનાવ બનેલ તે બાબતે અઠવા પો.સ્ટે. । ગુ.ર.નં.૧૩/૨૦૧૬ ઈ.પી.કો.કલમ ૩૨૩,૩૦૭,૩૦૨ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબથી ગુન્હો દાખલ થયેલ હોય સદર આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કૈદી તરીકે રહેતો હોય સદર આરોપીએ પોતાની પુત્રીની સ્કુલના એડમીશન લેવા સબબ તા.૦૩/૦૬/૧૯ થી તા.૯/૦૬/૧૯ સુધી વચગાળાની રજા ઉપર બહાર આવેલ ત્યારબાદ તેને તા.૧૦/૦૬/૧૯ ના રોજ સુરત સચીન લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમનો અનાદર કરી, સમયસર હાજર નહી થઈ વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ હતો દરમ્યાન પોલીસ માણસોને મળેલ બાતમી આધારે આરોપીને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.